



DO-1901300202040400 Seat No. _____

M. A. (Sem. IV) (CBCS) (W.E.F. 2019) Examination

March - 2022

Geography : Paper No.18

(Man and Environment System)

(New Course)

Time : $2\frac{1}{2}$ Hours] [Total Marks : **70**

- સૂચના :** (1) જરૂર જણાય ત્યાં સ્વચ્છ આકૃતિ/નકશો દોરો.
 (2) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.

1 પર્યાવરણ ભૂગોળનો અર્થ અને કાર્યક્ષેત્ર સમજાવો. **14**

અથવા

1 પૃથ્વીના પર્યાવરણના મહત્વને સમજાવો અને તેમના પ્રકારો વિશે વિસ્તૃત માહિતી આપો. **14**

2 માનવ અને પર્યાવરણ સંબંધનો ઈતિહાસ વિગતે સમજાવો. **14**

અથવા

2 ભારતના કોઈપણ એક ઈકોલોજિકલ પ્રદેશના સંદર્ભમાં તે પ્રદેશનો છોડ અને પ્રાણી જીવનનાં સંબંધ સમજાવો. **14**

3 વાયુ પ્રદૂષણ એટલે શું ? વાયુ પ્રદૂષણનાં જુદા જુદા ખોત જણાવો. **14**

અથવા

3 પર્યાવરણ અભ્યાસના અભિગમ્ભો વિશે વિસ્તૃત માહિતી આપો. **14**

4 કુદરતી આપત્તિની વ્યાખ્યા આપી તેમના વિશે વિસ્તૃત જાણકારી આપો. **14**

અથવા

4 પારિસ્થિતિક તંત્રની વ્યાખ્યા આપી તેના વર્ગીકરણની ચર્ચા કરો. **14**

5 નીચેની ચાર પૈકી કોઈ પણ બે ટૂંકનોંધ લખો :

- (1) નાઈટ્રોજ ચકો
- (2) પાણી, પ્રદૂષણ
- (3) પર્યાવરણ સમતુલ્યા
- (4) પ્રાકૃતિક પર્યાવરણ

ENGLISH VERSION

Instructions : (1) Draw neat figure / map wherever necessary.
(2) All questions carry equal marks.

- 1 Explain the meaning and scope of environmental geography. 14

OR

- 1 Explain the importance of the earth's environment and give detailed information about their types. 14

- 2 Examine in detail the chronology of 'man environment relationship'. 14

OR

- 2 Explain the relationship between plant and animal life of any one ecological region of India. 14

- 3 What is air pollution ? What are the different sources of air pollution ? 14

OR

- 3 Provide detailed information on approaches of environmental studies. 14

- 4 Define natural disasters and provide detailed information about them. 14

OR

- 4 Give the definition of ecosystem and discuss its classification. 14

- 5 Write any two of the following **four** short notes : 14

- (1) Nitrogen cycle.
- (2) Water pollution.
- (3) Environmental balance.
- (4) Physical environment.